

અમદાવદ મ્યુનિસિપલ કોર્પોરેશન  
મહાનગર સેવા સંદર્ભ  
સરદાર પટેલ ભવન  
આસ્ટોડીયા રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧



માહિતી(મેળવવાના) અધિકાર અધિનિયમ, ૨૦૦૫  
પ્રો-એક્ટીવ ડિસ્કલોગર  
(સને ૨૦૧૭)

ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ  
ફોન નં. ૨૫૩૯૮૯૯  
અંક. ૫૪૬, ૫૮૮, ૪૧૮, ૬૮૪,

એનેક્ષર-એ

(સામાન્ય વહીવટ વિભાગના તા. ૧.૫.૦૮ ના પરિપત્ર ક્રમાંક:- પીએડી-૧૦-૨૦૦૭-૩૩૫૩૬૪- આરટીઆઈ સેલનું  
બિડાણ)

પ્રમાણપત્ર

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે, મારી વડી કચેરી(પ્રોપર) તથા મારા વહીવટી કાર્યક્ષેત્રના આ સાથેની યાદી  
મુજબના જાહેર સત્તામંડળો દ્વારા માહિતી અધિકાર અધિનિયમની કલમ: ૪ અંતગત્ત સ્વયં જાહેર કરવાની બાબતો(પ્રોએક્ટીવ  
ડીસ્કોલોઝર) (P.A.D.) તૈયાર કરવામાં આવી છે તા.૦૧.૦૫.૨૦૧૭ ની સ્થિતિએ અધતન કરવામાં આવેલ છે, જેનું  
અમારા દ્વારા માટે મે ૨૦૧૭ દરમ્યાન ઈન્સપેક્શન-ક્રમ-ઓડીટ કરવામાં આવ્યું છે અને જે બાબતે ક્રતિ જણાઈ હતી અગર  
તો અપૂર્તિ વિગતો જણાઈ હતી તેની પૂર્તતા કરાવવામાં આવી છે.

૨. તા. ૧.૫.૨૦૧૭ ની સ્થિતિએ હવે કોઈ જાહેર સત્તામંડળોના પ્રોએક્ટીવ ડીસ્કોલોઝર (P.A.D.) નું ઈન્સપેક્શન- ક્રમ-  
ઓડીટ બાકી રહેલ નથી.

તા. ૨૩/૫/૨૦૧૭

જાહેર માહિતી અધિકારી  
વેલ્ક્રેક્ર ક્રમ લેબર ઓફિસર(આઈ.આર.)

એનેક્ષર-બી

(સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧.૦૭.૨૦૧૧ ના પરિપત્ર ક્રમાંક:- પીએડી-૧૦-૨૦૦૭-૩૩૫૩૬૪- આરટીઆઈ  
સેલનું બિડાણ)

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે, માહિતી અધિકાર અધિનિયમની કલમ: ૪ અંતગત્ત સ્વયં જાહેર કરવાની  
બાબતો પ્રોએક્ટીવ ડીસ્કોલોઝર (P.A.D.) મારા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે અને તા. ૧.૦૫.૨૦૧૭ ની  
સ્થિતિએ અમારી મંજૂરી મેળવી અધતન કરવામાં આવેલ છે.

તા. ૨૩.૫.૨૦૧૭

મુખ્ય મથક:- અમદાવાદ મ્યુ.કોપોરિશન  
સરદાર પટેલ ભવન, અમદાવાદ-૧

લેબર ઓફિસર  
ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાત

## પ્રમાણપત્ર

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે, તા.૧.૫.૧૭ થી તા.૩૦.૪.૧૮ દરમ્યાન મારા વહીવટી કાર્યક્ષેત્ર હેઠળની આ સાથેની યાદી મુજબના જાહેર સત્તામંડળો દ્વારા માહિતી અધિકાર અધિનિયમની કલમ: ૪ અંતર્ગત સ્વયં જાહેર કરવાની બાબતો “પ્રોએક્ટીવ ડિસ્કલોગર”(PAD) તૈયાર કરવામાં આવી છે. તેનું અમારા દ્વારા ઇન્સપેકશન-કમ-ઓડીટ કરવામાં આવ્યું છે અને જે બાબતે ક્ષતિ જણાઈ હતી અગર તો અપૂરતી વિગતો જણાઈ હતી તેની પૂર્તતા કરાવવામાં આવી છે.

૨. તા.૦૧-૦૫-૨૦૧૭ ની સ્થિતિએ આ સાથેની યાદી મુજબના જાહેર સત્તામંડળોના “પ્રોએક્ટીવ ડિસ્કલોગર”(PAD) નું ઇન્સપેકશન-કમ-ઓડીટ પૂર્ણ થઈ ગયેલ છે. તેનું પ્રમાણપત્ર મોકલી આપવામાં આવશે.

લેબર ઓફિસર

તારીખ: ૨૩/૦૫/૨૦૧૭

લેબર ઓફિસર મુખ્યમંથક: અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન, અમદાવાદ  
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન

## અનુક્રમણિકા

અનુક્રમ	વિષય	પાના
૧	ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાનું વહીવટી માળખું અને કામગીરી	૫ થી ૬
૨	ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના અધિકારી/ કર્મચારીઓની ફરજો તથા સત્તાઓ	૭ થી ૧૦
૩	ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના સ્ટાફની ડિરેક્ટરી	૧૧ થી ૧૨
૪	ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના અધિકારી/ કર્મચારીઓના માસિક મહેનતાણા/ ભથ્થાંની વિગત	૧૩ થી ૧૪
૫	સફાઈ કામદારોના વારસદારોને રહેમરાહે નોકરી આપવાના નિયમો બાબત	૧૫
૬	ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતામાં નિઃર્થ લેવામાં અનુસરવામાં આવતી પદ્ધતિ	૧૬
૭	પેન્ડિંગ ખાતાકીય તપાસની વિગતો	૧૭
૮	ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાનું મંજુર થયેલ બજેટ	૧૮
૯	ઇન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના એપેલેટ ઓથોરીટી, તથા જાહેર માહિતી અધિકારીની વિગત	૧૯

# ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાનું વહીવટી માળખુ અને કામગીરી

## (૧) વહીવટી માળખુ


- (એ) કચેરીનું સ્થળ :- અમદાવાદ મહાનગર સેવા સંદર્ભ  
સરદાર પટેલ ભવન, પ્રથમ માળે, "સી" બ્લોક  
સેન્ટ્રલ ઓફિસની બાજુમાં, દાણાપીઠ, અમદાવાદ-૩૮૦ ૦૦૧
- (બી) કચેરીનો સમય :- સવારના ૧૦:૩૦ થી ૬:૧૦ સુધી  
(૨:૦૦ થી ૨:૩૦ રીસેસ)
- (સી) ખાતાના વિભાગો:- મુખ્ય ચાર વિભાગમાં કામ કરે છે.  
 (૧) ખાતાનું એસ્ટાબ્લીશમેન્ટ  
 (૨) લેબર સેલ(લેબર કોર્ટની કામગીરી)  
 (૩) સફાઈ કામદારોના આશ્રિતોને નોકરી  
 (૪) ખાતાકીય તપાસ

## વહીવટી માળખુ

ડ.મ્યુનિ.કમિશનર(ઈન્ડસ્ટ્રીયલ રીલેશન)

લેબર ઓફિસર

આસી.મેનેજર(ઈન્ડસ્ટ્રીયલ રીલેશન)



## ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની મુખ્ય કામગીરી

- (૧) ભૂનિ.કોપોરેશનના તમામ ખાતાઓને મજૂર પ્રશ્રોમાં માર્ગદર્શન, સલાહ તથા અભિપ્રાયો આપવા.
- (૨) ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલ, લેબર કોર્ટ તથા લેબર કાયદાઓ નીચે રચાયેલ જુદી જુદી ઓથોરીટીઓ સમક્ષ દાખલ થયેલા કેસોનું સંકલન, ભૂનિ.કોપોરેશન તરફથી બચાવ કરવો, એડવોકેટોને માહિતી આપી જવાબો ફાઈલ કરવવા.
- (૩) ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલ તથા લેબર કોર્ટના એવોર્ડનો અમલ કરાવવા અથવા અપીલ કરવાની કામગીરી.
- (૪) મજૂર કમિશનરશીની કચેરીમાં ચાલતી કન્સીલીએશન કાર્યવાહીમાં રજુઆત કરવી, કન્ટ્રોલીંગ ઓથોરીટી તથા એપેલેટ ઓથોરીટી સમક્ષના ગ્રેજ્યુટીના કેસોની કામગીરી.
- (૫) યુનીયનોના પત્રો તથા રજુઆતો સ્વીકારવી અને સક્ષમ સત્તા પાસે નિર્ણય કરાવવો તથા યુનીયનોના હોદ્દેદારો તથા ઓથોરીટીઓ સાથે મીટિંગનું આયોજન.
- (૬) હેલ્થ કોન્જરવન્સી, રેફયુઝ તથા ખાળકુવા ખાતાના કામદારોના ભરણ તથા નોકરી દરમ્યાન (મેડીકલ તપાસમાં) અનફીટ થવાના પ્રસંગે તેમના વારસદારોને રહેમરાહે નોકરી આપવાની કામગીરી.
- (૭) ભૂનિ.કર્મચારીઓ તથા અધિકારીઓ વિરુધ્ધની ખાતાકીય તપાસની કામગીરી:- ચાર્જશીટ, શો કોઝ નોટિસ, શિક્ષાના હુકમોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષાના હુકમો ઈસ્યુ કરવા તથા અમલ કરાવવાની કામગીરી.
- (૮) બી.પી.એમ.સી. એકટ, ૧૯૪૮ ની કલમ: પદ(૪) નીચે કર્મચારીઓએ સ્ટે.કમિટીને કરેલ અપીલની કાર્યવાહી તથા અપીલમાં સ્ટે.કમિટીએ કરેલ ઠરાવના અમલ.
- (૯) સર્વિસ મેટરમાં આવેલ હાઇકોર્ટ, સીટી સીવીલ કોર્ટ, તથા અન્ય કોર્ટના ચુકાદાઓના અમલીકરણ તથા અપીલની કામગીરી.
- (૧૦) વાલ્બિકી સમાજના કર્મચારીઓના પ્રશ્નો અંગે મીટિંગનું આયોજન.

સને ૨૦૧૭

## ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના અધિકારી/ કર્મચારીની ફરજો તથા સત્તાઓ

અ. ન.	અધિકારી/ કર્મચારીનું નામ	હોદ્દો	સત્તાઓ			ફરજો/ કામગીરીની ટૂંકી વિગત
			વહીવટી	નાણાંકીય	અન્ય	
૧	ડૉ. નરેન જી. હજારી	લેબર ઓફિસર	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની તમામ વહીવટી સત્તાઓ	રૂ. ૧૦૦૦/-	-	<ul style="list-style-type: none"> <li>- ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની વહીવટી દેખરેખ, નિયંત્રણ તથા સુપરવીઝન</li> <li>- તમામ ખાતાઓને મજૂર પ્રશ્નોમાં સલાહ તથા માર્ગદર્શન આપવું.</li> <li>- ગુજરાત હાઈકોર્ટની સર્વાસ મેટરોની કામગીરી.</li> <li>- લેબર તથા ઈન્ડસ્ટ્રીયલ રીલેશન કામગીરી ઉપર દેખરેખ તથા સંકલન, સુપરવીઝન</li> <li>- સફાઈ કામદારોના વારસદારોને રહેમરાહે નોકરી આપવાની કાર્યવાહી</li> <li>- મજૂર પ્રશ્નોમાં વહીવટી અને નીતિ-વિષયક નિર્ણય લેવડાવવા.</li> </ul>
૨	શ્રી છિમાંશુ જી. ત્રિવેદી	આસી. મેનેજર	હાથ નીચેના સ્ટાફનું સુપરવિઝન અને દેખરેખ	-	-	<ol style="list-style-type: none"> <li>૧) તમામ ખાતાના કર્મચારીઓના સસ્પેન્શનના હુકમની કાર્યવાહી</li> <li>૨) તમામ ખાતાના કર્મચારીઓની શોકોઝ નોટીસ, ચાર્જશીટ, ફાઈનલ શોકોઝ નોટીસ તથા શિક્ષાના હુકમો સંબંધીત કાર્યવાહી</li> <li>૩) હાઈકોર્ટ એડવોકેટ સાથે સંકલનની કામગીરી</li> <li>૪) રાજ્ય સરકાર સાથે થતા પત્ર વ્યવહાર અંગેની કાર્યવાહીની કામગીરી</li> <li>૫) તમામ ડે.ભૂનિ.કમિશનરશીઓ સાથે કર્મચારીઓની સુનાવણી અંગેની કામગીરી તથા તેને આનુષાંગિક કાર્યવાહી</li> </ol>
૩	શ્રી ગુલામનબી જી. શેખ	વેલફેર કમ. લેબર ઓફિસર		-	-	<ol style="list-style-type: none"> <li>૧) તમામ ખાતાના કર્મચારીઓના સસ્પેન્શનના હુકમની કાર્યવાહી</li> <li>૨) તમામ ખાતાના ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલમાં ચાલતા કેસોની કામગીરી</li> <li>૩) બી.પી.એમ.સી.એક્ટની કલમ-૫૮(૪) નીચે થતી અપીલને લગતી કાર્યવાહી</li> <li>૪) તમામ ખાતાના લેબર કોર્ટના કેસોની કામગીરી</li> <li>૫) ભૂનિ.કર્મચારી સામે દાખલ થતા તથા દાખલ કરવામાં આવતાં પોલિસ કેસ તથા એ.સી.બી.કેસોની કામગીરી</li> <li>૬) સીટી સીવીલ કોર્ટ તથા હાઈકોર્ટના આઈ.આર.આતાને લગતાં કેસોની કામગીરી</li> <li>૭) આર.ટી.આઈ.ને લગતી ખાતામાં આવતી તમામ અરજીઓ તથા ડે.ભૂનિ.કમિ. (આર.ટી.આઈ.) શ્રી નાં ઓફિસ ઓર્ડર નં. ૨ તા. ૧૬/૧૨/૧૩ મુજબની કાર્યવાહી કરવી.</li> </ol>

૪	શ્રી અમરીષ ડી. જાની	વેલ્કેર કમ લેબર ઓફિસર		-	-	૧) લેબર કમિશરની કચેરીમાં ચાલતા કન્સીલીએશનના કેસોની કામગીરી ૨) કંટ્રોલીંગ ઓથોરીટી, એપેલેટ ઓથોરીટી તથા મજુર કાયદાઓ નીચે નિમાયેલ અન્ય ઓથોરીટીઓના કેસોની કામગીરી ૩) પશ્ચિમજોન, નવા પશ્ચિમજોન અને મધ્યજોન હેલ્પ કોન્ઝરવન્સી ખાતાના સફાઈ કામદારોના મરણ અને અનફીટ થવાના પ્રસંગે આશ્રિતોને નોકરી આપવાની કામગીરી
૫	શ્રી લક્ષ્મણભાઈ વી. ખાટા	વેલ્કેર કમ લેબર ઓફિસર		-	-	૧) રીમુવલને લગતી કામગીરી ૨) યુનીયનના પ્રશ્નો તથા સક્ષમ સત્તાઓ સમક્ષ યોજવામાં આવતી મીટિંગોની કામગીરી ૩) પૂર્વજોન, ઉત્તરજોન તથા દક્ષિણજોનના હેલ્પ કોન્ઝરવન્સી ખાતાના સફાઈ કામદારોના મરણ અને અનફીટ થવાના પ્રસંગે આશ્રિતોને નોકરી આપવાની કામગીરી
૬	શ્રી પુષ્પાબેન એસ. ગામેતી	સંકલન અધિકારી	ખાતાકીય તપાસ કચેરીના સ્ટાફનું સુપરવીઝન અને કામગીરી ઉપર ટેખરેખ	-	-	૧) તમામ ખાતાના કર્મચારીઓની શોકોઝ નોટીસ, ચાર્જશીટ, ફાઈનલ શોકોઝ નોટીસ તથા હુકમો સંબંધીત કાર્યવાહી (બજવાહી, કર્મચારીઓએ આપેલ જવાબ બાદની કાર્યવાહી) ૨) તમામ ડે.ભૂનિ.કમિશરશ્રીઓ સાથે કર્મચારીઓની સુનાવણી અંગેની કામગીરી તથા તેને આનુષ્ઠાંગીક કાર્યવાહી
૭	શ્રી ભરતસિંહ યુ.પરમાર	સ્ટેનોગ્રાફર (ફાળવણીથી)				- ખાતાકીય તપાસમાં આપવામાં આવતા ચાર્જશીટ, સર્પેન્શન, ફાઈનલ શો કોઝ નોટીસો, શિક્ષાના હુકમો કોમ્પ્યુટર ઉપર ટાઇપ કરવા. - ઈન્કવાયરી ઓફિસરોના રીપોર્ટ ટાઇપ કરવા. - ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાનું અન્ય કાગળોનું ટાઇપીંગ
૮	શ્રી અચ્યુનકુમાર એમ. પંચા	ટાઇપિસ્ટ		-	-	- ખાતાકીય તપાસમાં આપવામાં આવતા ચાર્જશીટ, સર્પેન્શન, ફાઈનલ શો કોઝ નોટીસો, શિક્ષાના હુકમો કોમ્પ્યુટર ઉપર ટાઇપ કરવા. - ઈન્કવાયરી ઓફિસરોના રીપોર્ટ ટાઇપ કરવા. - ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાનું અન્ય કાગળોનું ટાઇપીંગ
૯	શ્રી મહેશકુમાર બી.પારેખ	જી.કો. ઓપરેટર		-	-	- ખાતાકીય તપાસના ચાર્જશીટ, શો કોઝ નોટીસ, સર્પેન્શન હુકમ, શિક્ષાના હુકમોના ડ્રાફ્ટ કોમ્પ્યુટર ઉપર ટાઇપ કરવા. - ઈન્કવાયરી ઓફિસરોના રીપોર્ટ ટાઇપ કરવા. - ખાતાની અન્ય ટાઇપીંગ કામગીરી
૧૦	શ્રી બ્રિજેશકુમાર જે. નાયક	સ્ટેનોગ્રાફર		-	-	- હાલમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર ખાતે ફાળવણીથી ફરજ બજાવે છે.

૧૧	શ્રી ભાનુપ્રસાદ જે. પટેલ	સીની.કલાર્ક		-	-	<ul style="list-style-type: none"> <li>- ચાર્જશીટના ડ્રાફ્ટ ટાઈપ કરાવવા, કમ્પેર કરવા અને સક્ષમ સત્તા સમક્ષ એપ્રુવલ માટે મુકવા</li> <li>- એપ્રુવ થયેલ ચાર્જશીટના ડ્રાફ્ટ જેતે કર્મચારીને બજાવવા મોકલવા તથા ફાઈલ ઈન્કવાયરી ઓફિસરને મોકલવી</li> </ul>
૧૨	શ્રી મધુરીબેન સી.પટેલ	સીની.કલાર્ક		-	-	<ul style="list-style-type: none"> <li>- ઈન્કવાયરી ઓફિસરના રીપોર્ટ ઉપર સક્ષમ સત્તાએ શિક્ષા અંગે જે નિષ્ણય લીધેલ હોય તેના અનુસંધાનમાં તૈયાર કરેલ શો કોઝ નોટિસના ડ્રાફ્ટ ટાઈપ કરાવી સક્ષમ સત્તા સમક્ષ મુકવા</li> <li>- એપ્રુવ થયેલ શો કોઝ નોટિસ જેતે કસુરદાર કર્મચારીને ઈસ્યુ કરવી.</li> </ul>
૧૩	શ્રી જ્યોતિબેન એ. પટેલ	સીની.કલાર્ક		-	-	<ul style="list-style-type: none"> <li>- ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના એસ્ટાબ્લિસમેન્ટની કામગીરી</li> <li>- ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના સ્ટાફના પગાર તથા સર્વસિ બુકની જાળવણી</li> <li>- લેબર કોર્ટ, ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલ કેસોના રજીસ્ટરોની જાળવણી તથા મેઇન્ટેનાન્સ</li> <li>- ખાતાના અન્ય પરચુરણ બીલોની કામગીરી</li> </ul>
૧૪	શ્રી સુભદ્રાબેન પી. પટેલ	સીની.કલાર્ક		-	-	<ul style="list-style-type: none"> <li>- સેન્ટ્રલ ઓફિસ તથા વિજીલન્સ ખાતા દ્વારા હાથ ધરવામાં આવતા સરપાઈજ ચેકિંગમાં ગેરહાજર માલુમ પડતા કર્મચારીઓને શો કોઝ નોટિસો તૈયાર કરવી, એપ્રુવ કરાવવી તથા ઈસ્યુ કરવી.</li> <li>- ઉપરોક્ત શો કોઝ નોટિસના ખુલાસાઓ મેળવવા અને સક્ષમ સત્તા સમક્ષ મુક્ત નિષ્ણય કરાવવો.</li> <li>- શિક્ષાના હુકમો તૈયાર કરવા અને ઈસ્યુ કરવા</li> <li>- પ્રમોશન તથા કાયમ કરવા સમયે કર્મચારીઓને ખાતાકીય તપાસનું એન.ઓ.સી. આપવું.</li> </ul>
૧૫	શ્રી ભીખાભાઈ એમ. પટેલ	સીની.કલાર્ક		-	-	<ul style="list-style-type: none"> <li>- ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના ખાતાકીય તપાસ ક્યેરીની ટપાલ લેવી, ઈન્વર્ડ કરવી તથા જેતે અવિકારી સમક્ષ મુકવાની કામગીરી</li> <li>- દફ્તરે થતી ઈન્કવાયરી ફાઈલોની વર્ગિકરણ અને જાળવણી</li> <li>- આઈ.આર.ઇએસ.ટી. ના હુકમો ઈસ્યુ કરવાની કામગીરી</li> </ul>
૧૬	શ્રી કમલેશ એચ. પુરોહિત	સીની.કલાર્ક		-	-	<ul style="list-style-type: none"> <li>- રાઈટ ટુ ઈન્ફોર્મેશન નીચેની અરજની કામગીરી.</li> <li>- આવશ્યક સેવાના જહેરનામા તથા આઈ.આર. ખાતાને લગતી તમામ મેટરોમાં રાજ્ય સરકાર સાથે, એ.સી.બી. ઓફિસ, શ્રમ ભુવન, પોલીસ સ્ટેશનો, યુનિવર્સિટી તથા સચિવાલયમાં લાયેજનીંગની તમામ કામગીરી.</li> </ul>
૧૭	શ્રી ભાવિશાબેન પી. પટેલ	જુનિ. કલાર્ક		-	-	<ul style="list-style-type: none"> <li>- ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના ઈન્કવાયરી સેલ સિવાયની તમામ ટપાલ લેવી, ઈન્વર્ડ કરી લેબર ઓફિસરને મુક્તી તથા ટપાલ આઉટવર્ડ કરી જેતે ખાતાઓને મોકલવી.</li> <li>- બી.પી.એમ.સી. એકટની કલમ: પદ(૪) નીચે થતી અપીલની કામગીરી.</li> </ul>

						- ઈન્કવાયરી ઓફિસરના પત્રો તથા ખાતાના અન્ય પત્રોના પોસ્ટ- ૨જ.પોસ્ટ એડી.ની કામગીરી
૧૮	શ્રી રમણભાઈ પી. શર્મા	પટાવાળા		-	-	- ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની તમામ બહારના ખાતાઓના ટપાલની કામગીરી
૧૯	શ્રી ગોવિંદભાઈ પી. નાથી	પટાવાળા		-	-	- ખાતાકીય તપાસ કચેરીના પટાવાળાની કામગીરી અને ખાતાકીય તપાસને લગતી ફાઈલોની કામગીરી.
૨૦	શ્રી પોપટભાઈ જી. વાધેલા	પટાવાળા		-	-	- ઈન્કવાયરી ઓફિસરો પાસે પટાવાળાની કામગીરી
૨૧	શ્રી જસપાલ રતનલાલ રોટ	પટાવાળા		-	-	- ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાની અંદરના ખાતાઓની ટપાલની કામગીરી
૨૨	શ્રી પોપટભાઈ બી. રાવળ	પટાવાળા		-	-	- લેબર ઓફિસરની મુખ્ય ઓફિસે પટાવાળાની કામગીરી, તથા બહારના ખાતાઓની ટપાલની કામગીરી.

★ શ્રી ભરતસિંહ યુ.પરમાર , શ્રી મહેશકુમાર બી.પારેખ, શ્રી મયુરીબેન સી.પટેલ તથા શ્રી જ્યોતિબેન એ. પટેલ નો પગાર આઈ.આર. ખાતેથી નીકળતો નથી.

## ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના સ્ટાફની ડિરેક્ટરી

અ. નં.	એમ્બ્લોઈંગ નંબર	નામ	હોદ્દો	ફોન નંબર			ફેક્સ	ઈ-મેઇલ
				ક્યેરી	મોબાઈલ	ધર		
૧	૮૩૭૫	ડૉ. નરેન જી. હજારી	લેબર ઓફિસર	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૪૪૬)	૯૮૨૭૦૩૮૭૭૩	૦૭૯- ૨૫૩૮૪૭૪૪		narenhajari@ahmedabadcity.gov.in
૨	૭૮૨૪	શ્રી હિમાંશુ જી. ત્રિવેદી	આસી. મેનેજર	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૪૮૮)	૯૮૨૭૫૫૪૮૯૨	--	--	htrivedi@ahmedabadcity.gov.in
૩	--	શ્રી ગુલાબનની જી. શેખ	ડબલ્યુ. એલ.ઓ.	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૪૧૮)	૯૮૨૮૩૮૫૫૬૪	--	--	
૪	૮૩૮૧	શ્રી અમરિષ ડી. જાની	ડબલ્યુ.એ. લાંબો	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૪૧૮)	૯૮૨૮૩૮૫૫૬૫	--	--	
૫	૮૫૨૭	શ્રી વિક્રમશાખાઈ વી. ખાટા	ડબલ્યુ.એ. લાંબો	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૪૧૮)	૯૮૨૭૦૩૮૮૪૩			
૬	૮૪૭૦	શ્રી પુષ્પાભેન એસ. ગામેતી	સંકલન અધિકારી	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૬૮૪)	--	--	--	
૭	--	શ્રી એન.એચ. લાલવાડી	સંકલન અધિકારી	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૬૮૪)	--	--	--	
૮	૭૨૦૭૪	શ્રી ભરતસિંહ યુ.પરમાર	સ્ટેનોગ્રાફર	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૪૧૮)	૯૭૧૨૮૭૦૬૮૦			
૯	--	શ્રી અશ્વિન એમ. પંડ્યા	ટાઈપીસ્ટ કમ કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૬૮૪)				
૧૦	૭૨૧૫૩	શ્રી મહેશકુમાર બી. પારેખ	જુ.કો. ઓપરેટર	૨૫૩૮૯૮૯૯ (અક્ષ. ૬૮૪)				
૧૧	૭૨૦૮૭	શ્રી બ્રિજેશકુમાર	સ્ટેનોગ્રાફર	૨૩૨૫૧૦૧૪ શહેરી વિકાસ અને				

		જે. નાયક		શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગર				
૧૨	૭૮૨૫	શ્રી ભાનુપ્રસાદ જે. પટેલ	સીની. કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (અંક. ૬૮૪)				
૧૩	૮૬૦૫	શ્રી સુભદ્રાબેન પી. પટેલ	સીની. કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (અંક. ૬૮૪)				
૧૪	૬૮૪૮	શ્રી મયુરી સી. પટેલ	સીની. કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (અંક. ૬૮૪)				
૧૫	૭૮૨૭	શ્રી ભીખાભાઈ અમ. પટેલ	સીની. કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (અંક. ૬૮૪)				
૧૬	૮૬૮૭	શ્રી કમલેશભાઈ અચ. પુરોહિત	સીની. કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (અંક. ૬૮૪)				
૧૭	૮૮૮૫	શ્રી જ્યોતીબેન એ. પટેલ	સીની. કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (અંક. ૬૮૪)				
૧૮	૯૪૦૩	શ્રી ભાવિશાબેન પી. પટેલ	જુની. કલાર્ક	૨૫૩૮૯૮૯૯ (અંક. ૬૮૪)				
૧૯	૩૪૦૮૨	શ્રી રમણભાઈ પી. શર્મા	પટાવાળા	૨૫૩૮૯૮૯૯ (અંક. ૬૮૪)				
૨૦	૩૪૧૨૩	શ્રી ગોવિંદભાઈ પી. નાયી	પટાવાળા	૨૫૩૮૯૮૯૯ (અંક. ૬૮૪)				
૨૧	૮૧૦૭૪	શ્રી પોપટલાલ જી. વાંદેલા	પટાવાળા	૨૫૩૮૯૮૯૯ (અંક. ૮૧૦)				
૨૨	૩૮૧૮૪	શ્રી જસપાલ આર. રોત	પટાવાળા	૨૫૩૮૯૮૯૯ (અંક. ૬૮૪)				
૨૩	૩૮૩૩૦	શ્રી પોપટભાઈ બી. રાવળ	પટાવાળા	૨૫૩૮૯૮૯૯ (અંક. ૬૮૪)				

## ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના અધિકારી/ કર્મચારીઓના માસિક મહેનતાણાનું સ્ટેટમેન્ટ

અ. નં.	એમ્પ્લોઈ નં.	નામ	હોદ્દો	માસિક મહેનતાણાનું / પગાર	વળતર ભથ્થું	નાતિનિયમ મુજબ મહેનતાણાનું નક્કી કરવાની પદ્ધતિ
૧.	૮૩૭૫	ડૉ. નરેન જી. હજારી	લેબર ઓફિસર	૬૭૭૦૦-૨૦૮૭૦૦ (બેઝીક પગાર : ૭૧૮૦૦)	કોર્પોરેશન દ્વારા વાહન ફાળવવામાં આવેલ છે.	રાજ્ય સરકારના પગાર પંચ અન્યે પગાર ધોરણનો અમલ કરવામાં આવે છે.
૨.	૭૮૨૪	શ્રી હિમાંશુ જી. ત્રિવેદી	આસી. મેનેજર	૬૭૭૦૦-૨૦૮૭૦૦ (બેઝીક પગાર : ૮૧૧૦૦)	મોટરસાયકલ એલાઉન્સ	“““““
૩.	----	શ્રી ગુલામનભી જી. શેખ	ડબલ્યુ. એલ. ઓ.	ઉચ્ચક માસિક વેતન રૂ. ૨૫૦૦૦/-	----	“““““
૪.	૮૩૮૧	શ્રી અમરીષ ડી. જાની	ડબલ્યુ. એલ. ઓ.	૫૩૧૦૦-૧૬૭૮૦૦ (બેઝીક પગાર : ૭૧૩૦૦)	મોટરસાયકલ એલાઉન્સ	“““““
૫.	૮૫૨૭	શ્રી લક્ષ્મણભાઈ વી. ખાટા	ડબલ્યુ. એલ. ઓ.	૪૪૬૦૦-૧૪૨૪૦૦ (બેઝીક પગાર : ૫૮૬૦૦)	મોટરસાયકલ એલાઉન્સ	“““““
૬.	૮૪૭૦	શ્રી પુષ્પાબેન એસ. ગામેતી	સંકલન અધિકારી	૪૪૬૦૦-૧૪૨૪૦૦ (બેઝીક પગાર : ૫૭૬૦૦)	-----	“““““
૭.	--	શ્રી એન. એચ. લાલવાડી	સંકલન અધિકારી	ઉચ્ચક માસિક વેતન રૂ. ૨૦,૦૦૦/-	-----	“““““
૮.	૭૨૦૭૪	શ્રી ભરતસિંહ યુ. પરમાર	સ્ટેનોગ્રાફર	૪૪૬૦૦-૧૪૨૪૦૦ (બેઝીક પગાર : ૬૮૦૦૦)	-----	“““““
૯.	----	શ્રી અધ્યનકુમાર એમ. પંડ્યા	ટાઇપીસ્ટ ક્રમ કલાર્ક	ઉચ્ચક માસિક વેતન રૂ. ૧૨૦૦૦/-	--	“““““
૧૦.	૭૨૧૫૩	શ્રી મહેશકુમાર બી. પારેખ	જુ.કો.ઓપરેટર	૨૫૫૦૦-૮૧૧૦૦ (બેઝીક પગાર : ૩૫૩૦૦)	--	“““““
૧૧.	૭૨૦૮૭	શ્રી બ્રિજેશકુમાર જે. નાયક	સ્ટેનો ગ્રાફર	૪૪૬૦૦-૧૪૨૪૦૦ (બેઝીક પગાર : ૬૮૦૦૦)	-----	“““““

૧૨.	૭૮૨૫	શ્રી ભાનુપ્રસાદ જે.પટેલ	સીની. કલાર્ક	૩૫૪૦૦-૧૧૨૪૦૦ (બેઝીક પગાર : ૪૭૬૦૦)	“	“““““
૧૩.	૭૬૯૨	શ્રીમતી સુભદ્રાબેન પી. પટેલ	સીની. કલાર્ક	૩૫૪૦૦-૧૧૨૪૦૦ (બેઝીક પગાર : ૪૬૨૦૦)	“	“““““
૧૪.	૬૮૪૮	શ્રીમતી મયુરીબેન સી.પટેલ	સીની.કલાર્ક	૩૫૪૦૦-૧૧૨૪૦૦ (બેઝીક પગાર : ૪૬૦૦૦)		
૧૫.	૭૮૨૭	શ્રી ભીખાભાઈ એમ. પટેલ	સીની. કલાર્ક	૩૫૪૦૦-૧૧૨૪૦૦ (બેઝીક પગાર : ૪૬૦૦૦)	“	“““““
૧૬.	૮૬૮૭	શ્રી કમલેશ એચ. પુરોહિત	સીની. કલાર્ક	૩૫૪૦૦-૧૧૨૪૦૦ (બેઝીક પગાર : ૪૬૨૦૦)	“	“““““
૧૭.	૮૮૮૫	શ્રી જ્યોતિબેન એ. પટેલ	સીની.કલાર્ક	૩૫૪૦૦-૧૧૨૪૦૦ (બેઝીક પગાર : ૪૬૨૦૦)		
૧૮.	૯૩૮૨	શ્રીમતી ભાવિશાબેન પી. પટેલ	જુની. કલાર્ક	૨૫૫૦૦-૮૧૧૦૦ (બેઝીક પગાર : ૩૬૪૦૦)	“	“““““
૧૯.	૩૫૩૩૦	શ્રી રાવળ પોપટભાઈ બી.	પટાવણા	(૧૪૮૦૦-૪૭૧૦૦) (બેઝીક પગાર : ૧૬૨૦૦)	“	“““““
૨૦.	૩૫૧૮૨	શ્રી જસપાલ આર. રોત	પટાવણા	(૧૪૮૦૦-૪૭૧૦૦) (બેઝીક પગાર : ૧૭૨૦૦)	“	“““““
૨૧.	૩૪૦૯૨	શ્રી રમણભાઈ પી. શર્મા	પટાવણા	(૧૬૬૦૦-૬૩૨૦૦) (બેઝીક પગાર : ૩૧૧૦૦)	“	“““““
૨૨.	૩૪૧૨૩	શ્રી ગોવિંદભાઈ પી. નાઈ	પટાવણા	(૧૬૬૦૦-૬૩૨૦૦) (બેઝીક પગાર : ૩૩૦૦૦)	“	“““““
૨૩.	૯૧૦૭૪	શ્રી પોપટલાલ જી. વાધેલા	પટાવણા	(૧૫૭૦૦-૫૦૦૦૦) (બેઝીક પગાર : ૩૧૧૦૦)	“	“““““

- શ્રી ભરતસિંહ યુ.પરમાર ,શ્રી મહેશકુમાર બી.પારેખ, શ્રી મયુરીબેન સી.પટેલ, તથા શ્રી જ્યોતિબેન એ. પટેલ નો પગાર આઈ.આર. ખાતેથી નીકળતો નથી.

**સફાઈ કામદારોના વારસદારોને રહેમરાહે નોકરી આપવા માટેના નિયમો**

(૧)	નિયમોનું નામ	સફાઈ કામદારો, રેફયુઝ તથા ખાળુકવા ખાતાના કામદારોને ભરણ તથા નોકરી દરમ્યાન અનફીટ થાય તો તેના વારસદારને રહેમરાહે નિમણૂક આપવી
(૨)	દસ્તાવેજનો પ્રકાર	<ul style="list-style-type: none"> <li>(૧) સ્ટે.કમિટી દરાવ નં. ૧૨૮૬, તા. ૧૮.૧.૦૬</li> <li>(૨) ભ્યુ.કો.દરાવ નં. ૧૦૮૩, તા. ૧૮.૧.૦૬</li> <li>(૩) રહેમરાહે નોકરી આપવાના નિયમો પરિશિષ્ટ-એ</li> <li>(૪) ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ, સરક્યુલર નં. ૧, તા. ૨૮.૬.૦૬</li> <li>(૫) ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ સરક્યુલર નં. ૧, તા. ૧૧.૬.૦૮</li> <li>(૬) પ્રે વર્ધનો સરક્યુલર તા. ૧૮.૫.૨૦૧૦</li> <li>(૭) સ્ટે.કમિટી દરાવ નં. ૩૫૬, તા. ૨૦.૬.૧૫, ભ્યુ.કો.દરાવ નં. ૪૭૫ તા. ૨૮.૭.૧૫ મુજબ, ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ, સરક્યુલર નં. ૧, તા. ૨૮.૬.૧૫</li> </ul>
(૩)	વારસદારની નોકરીના નિયમોની નકલ કયાંથી મળી શકશે	લેબર ઓફીસર ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ ફોન નં. ૨૫૩૮૯૮૯૯ EPBX- ૫૪૬, ૪૧૮

## નિર્ણય લેવામાં અનુસરવામાં આવતી પદ્ધતિ

ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાના ગ્રાણ વિભાગો (૧) એસ્ટાબ્લીસમેન્ટ (૨) લેબર-વેલ્કર તથા (૩) ખાતાકીય તપાસ વિભાગમાં નિર્ણય લેવા માટે ફાઈલ નીચેના કમમાં મુકવામાં આવે છે.

(૧) એસ્ટાબ્લીસમેન્ટ - જુનિ. કલાર્ક સીની. કલાર્ક આસી. મેનેજર આઈ.આર. લેબર ઓફિસર ડે. મ્યુનિ. કમિશર (આઈ.આર.)

(૨) લેબર વેલ્કર ઓફિસર  
(વારસદારની નિમણૂંક કરવાની) W.L.O. આસી. મેનેજર આઈ.આર. લેબર ઓફિસર ડાયરેક્ટર  
(એસ.અ.બલ્યુ.એમ)

(૩) ખાતાકીય તપાસ વિભાગ

<span style="border: 1px solid black; padding: 2px;">ઈન્કવાયરી ઓફિસર</span>	<span style="border: 1px solid black; padding: 2px;">સંકલન અધિકારી આઈ.આર.</span>	<span style="border: 1px solid black; padding: 2px;">લેબર ઓફિસર</span>
---	--	--

<span style="border: 1px solid black; padding: 2px;">આસી. મેનેજર આઈ.આર.</span>	<span style="border: 1px solid black; padding: 2px;">લેબર ઓફિસર</span>
--	--

<span style="border: 1px solid black; padding: 2px;">ડે. મ્યુનિ. કમિ. (પ.જોન /આઈ.આર.)</span>
<span style="border: 1px solid black; padding: 2px;">ડે. મ્યુનિ. કમિ. (નવા પશ્ચિમ/સીએનસી.ડી.)</span>
<span style="border: 1px solid black; padding: 2px;">ડે. મ્યુનિ. કમિ. (મધ્યઝોન/ ઈ.ગર્વનન્સ)</span>
<span style="border: 1px solid black; padding: 2px;">ડે. મ્યુનિ. કમિ... (પૂર્વઝોન/ એસ્ટેટ/ટીડીઓ)</span>
<span style="border: 1px solid black; padding: 2px;">ડે. મ્યુનિ. કમિ. (ઉત્તરઝોન/વહીવટ)</span>
<span style="border: 1px solid black; padding: 2px;">ડે. મ્યુનિ. કમિ. (દક્ષિણઝોન/હેઠ્ય)</span>

<span style="border: 1px solid black; padding: 2px;">મ્યુનિ. કમિશર</span>
---

મ્યુનિસિપલ કર્મચારીઓ / અધિકારીઓ સામેની પેન્ડિંગ ખાતાકીય તપાસ

(૩૦-૪-૧૭ ની સ્થિતિ)

નં.	ઈન્કવાયરી ઓફિસરનું નામ	છેલ્લા વર્ષ દરમાન નિકાલ કરેલ ખાતાકીય તપાસ	હાલ પેન્ડિંગ ખાતાકીય તપાસ	હાલ પેન્ડિંગ ખાતાકીય તપાસ				
				૫ વર્ષથી વપુ	૪ વર્ષથી વપુ	૩ વર્ષ સુધીની	૨ વર્ષ સુધીની	૧ વર્ષ સુધીની
૧	શ્રી એસ.કે. ઠાકર અ.મ્યુ.કો.નિવૃત લેબર કમ વેલ્કર ઓફિસર	૧૨	૦૯	--	--	--	--	--
૨	શ્રી એસ.એન.શુક્લ રાજ્ય સરકારના નિવૃત અધિકારી	૨૭	૧૨	૦૨	--	--	--	૦૪
૩	શ્રી એલ.એ.શાહ રાજ્ય સરકારના નિવૃત અધિકારી	૧૦	૧૨	--	--	--	--	૦૬
૪	શ્રી રમણસિંહ બી.બારીયા રાજ્ય સરકારના નિવૃત અધિકારી	૧૫	૦૭	--	--	--	--	૦૧

## ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતાનું મંજુર થયેલ બજેટ

(હજારમાં)

વીપાટ્મેન્ટ / એકાઉન્ટ કોડ	ખાતુ તથા એકાઉન્ટ હેડનું નામ	૨૦૧૪-૧૫	૨૦૧૫-૧૬	૨૦૧૬-૧૭	૨૦૧૭-૧૮
૧૦૭ ૩૦૧૮૮	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતુ પગાર ખર્ચ	૮૨૦૫	૧૧૫૨૧	૧૧૧૮૪	૧૩૭૫૦
૩૦૩૦૨	ટેલીફોન બીલ રહેઠાણ	૦૪	૦૬	૦૮	૦૮
૩૦૪૦૧	યુનિફોર્મ	૧૪	૧૪	૧૪	૧૦
૩૪૧૦૧	ટેલીફોન તથા ટ્રાન્કિલ (ઓફિસ)	૧૦૦	૧૦૦	૧૦૦	૫૦
૩૪૧૦૨	પોસ્ટેજ તથા ટેલીગ્રામ	૧૫	૧૫	૨૫	૨૫
૩૪૪૦૧	સ્ટેશનરી	૭૦	૧૦૦	૧૦૦	૧૦૦
૩૪૪૦૪	પ્રિન્ટિંગ	૧૦	૫૦	૫૦	૫૦
૩૪૪૦૫	એરોક્ષ	૩૦	૪૦	૪૦	૪૦
૩૪૪૦૮	પુસ્તકો, અખભારો અને સામયિકો	૦૮	૦૮	૦૮	૦૮
૩૪૮૮૮	અન્ય ખર્ચ	૬૫	૬૫	૭૫	૭૫

## એપેલેટ અધિકારી તથા જાહેર માહિતી અધિકારીની વિગતો

નં.	નામ	હોદ્ડો	ફોન નંબર			ફેક્સ	ઈ-મેઇલ	સરનામું
			ઓફિસ	મોબાઈલ	ઘર			
૧.	ડૉ નરેન જી. હજારી	એપેલેટ અધિકારી	૨૫૭૮૯૮૯૯ અક્ષ. ૫૪૬	૯૩૨૭૦૩૮૭૭૩	૦૭૯- ૨૫૩૮૪૭૪૪	--	narenhajari @ahmedab adcity. gov.in	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતું, અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન, ૧લો માળ, સરદાર પટેલ ભવન, મધ્યરથ કચેરી, દાણાપીઠ, અમદાવાદ
૨.	શ્રી ગુલામનભી જી. શેખ	જાહેર માહિતી અધિકારી	૨૫૭૮૯૮૯૯ અક્ષ. ૪૧૮	૯૩૨૮૩૮૫૫૬૪	--	--	--	ઈન્ડસ્ટ્રીયલ રીલેશન ખાતું, અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન, ૧લો માળ, સરદાર પટેલ ભવન, મધ્યરથ કચેરી, દાણાપીઠ, અમદાવાદ